

ત્વરિત જાહેરાત માટે

## સીટી ઓફ બ્રેમ્પટને ડેપ્યુટી મેયર પદ સ્થાપિત કર્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 6, 2022) – સીટી ઓફ બ્રેમ્પટને કાઉન્સિલ અને અન્ય કમિટી મીટિંગ્સમાં પ્રમુખપદ સંભાળવા અને મેયર વતી ઔપચારિક અને નાગરિક પ્રસંગોની ફરજો નિભાવવા ડેપ્યુટી મેયર પદ સ્થાપિત કર્યું છે.

ડેપ્યુટી મેયરનું પદ બે ભાગમાં વિભાજિત કરવામાં આવશે, જેનાથી શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગોનું પ્રતિનિધિત્વ થશે. કાઉન્સિલની આ ટર્મ (સમયગાળા) માટે પૂર્વાયિ બ્રેમ્પટનનું પ્રતિનિધિત્વ પેટ ફોર્ટિની (Pat Fortini), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8, અને પશ્ચિમી બ્રેમ્પટનનું પ્રતિનિધિત્વ માર્ટિન મેડીરોસ (Martin Medeiros), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4 સંભાળશે.

અગાઉ સીટી ઓફ બ્રેમ્પટનના પ્રોસિજર બાય-લો 160-2004 હેઠળ, મેયર અનુપલબ્ધ હોય ત્યારે કાર્યકારી મેયરની નિયુક્તિ કાઉન્સિલ અને અન્ય કમિટી મીટિંગ્સનું પ્રમુખપદ સંભાળવા અને નાગરિક પ્રસંગોની ફરજો નિભાવવા માટે કરવામાં આવી હતી. આ ભૂમિકા બધાં કાઉન્સિલર્સ સહિત પૂર્વ-નિર્ધારિત રોટેટિંગ (ફરતા) માસિક રોસ્ટર (નામોની યાદી)થી ભરવામાં આવતી હતી. જો મેયર અને બંને ડેપ્યુટી મેયર્સ અનુપલબ્ધ હોય તો, કાર્યકારી મેયર મીટિંગ્સનું પ્રમુખપદ સંભાળવાનું અને સીટી વતી પ્રસંગોમાં હાજર રહેવાનું ચાલુ રાખશે.

બ્રેમ્પટન સીટી કાઉન્સિલ અને કમિટીસ પર વધુ માહિતી વેબસાઇટ [Brampton.ca](http://Brampton.ca) પર જોઈ શકાય છે.

### અવતરણ (ક્વોટ):

"બ્રેમ્પટન સીટી કાઉન્સિલ સમગ્ર શહેરમાં રહેવાસીઓની જરૂરિયાતો પૂરી કરવા સામૂહિક રીતે કટિબદ્ધ છે. હું પૂર્વાયિ બ્રેમ્પટન વતી ડેપ્યુટી મેયરની ભૂમિકા ભજવવામાં રોમાંચ અનુભવું છું અને ઔપચારિક અને નાગરિક પ્રસંગોમાં આપણાં વધારે સમુદાયોને મળવાની આશા રાખું છું."

- પેટ ફોર્ટિની (Pat Fortini), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ડેપ્યુટી મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટન સીટી કાઉન્સિલ સાથે મળીને, સીટીના ધંધાઓ ચલાવવાનો અને આપણાં સમુદાયોને સેવા આપવાનો જુરસો ધરાવે છે. હું ડેપ્યુટી મેયર તરીકે પશ્ચિમી બ્રેમ્પટનનું પ્રતિનિધિત્વ કરવામાં ગૌરવ અનુભવું છું, અને આ ક્ષમતામાં આપણાં શહેરને સેવા આપવાનું ચાલુ રાખવાની આશા રાખું છું."

- માર્ટિન મેડીરોસ (Martin Medeiros), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 3 અને 4; ડેપ્યુટી મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/Brampton), [Facebook](https://facebook.com/Brampton), અને [Instagram](https://instagram.com/Brampton) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**मिडिया संपर्क (MEDIA CONTACT):**

सीटी ओफ़ ब्रॅम्पटन मल्टिकल्चरल मिडिया

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)